



ગુજરાત જાહેર સેવા આયોગ

અગત્યની સૂચના (Important Notice)

આર્થિક રીતે નબળા વર્ગો માટે અનામતની નીતિના અમલના કારણે આયોગ ધ્વારા વર્ષ ૨૦૧૮ માં પ્રસિધ્ધ કરવામાં આવેલ નીચે મુજબની જાહેરાતો અન્વયે કેટલીક જગ્યાઓ હવે આર્થિક રીતે નબળા વર્ગોના ફાળે જતી હોઇ, આ જાહેરાતો Re-open કરવામાં આવે છે. આ સાથેની સૂચનાઓ મુજબ સંબંધિત ઉમેદવારોએ આયોગની વેબસાઇટ <https://gpsc-ojas.gujarat.gov.in> પર તા. ૧૮.૦૩.૨૦૧૯ (૧૩:૦૦ કલાક) થી તા. ૧૮.૦૪.૨૦૧૯(૧૩:૦૦ કલાક) સુધીમાં ઓન લાઇન અરજી કરવાની રહેશે. આ જાહેરાતો માટેની પ્રાથમિક કસોટીની સંભવિત તારીખ, પ્રાથમિક કસોટીના પરિણામનો સંભવિત માસ, રૂબરૂ મુલાકાતનો સંભવિત માસ વગેરે માહિતી તા. ૧૫.૦૩.૨૦૧૯ ના રોજ વર્તમાન પત્રોમાં પ્રસિધ્ધ થયેલ જાહેરાતમાં દર્શાવવામાં આવેલ છે. ઉપરાંત આયોગની વેબસાઇટ <https://gpsc.gujarat.gov.in> પર અદ્યતન પરીક્ષા કાર્યક્રમ પણ પ્રસિધ્ધ કરવામાં આવશે.

ક્રમ	જાહેરાત ક્રમાંક	જગ્યાનું નામ
૦૧	૪૯/૧૮-૧૯	મદદનીશ ઇજનેર (યાંત્રિક), વર્ગ-૨ (ન.જ.પા.પું અને કલ્પસર વિભાગ)
૦૨	૫૧/૧૮-૧૯	સંશોધન અધિકારી, વર્ગ-૨ (ગુજરાત આકાશવાણી સેવા) (સામાન્ય વહીવટ વિભાગ)
૦૩	૭૯/૧૮-૧૯	મદદનીશ ઇજનેર (સીવીલ), વર્ગ-૨ (માર્ગ અને મકાન વિભાગ)
૦૪	૮૦/૧૮-૧૯	રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩
૦૫	૧૦૩/૧૮-૧૯	માઇક્રોબાયોલોજિસ્ટ, વર્ગ-૦૧, તજજ્ઞ સેવા
૦૬	૧૦૪/૧૮-૧૯	પેથોલોજિસ્ટ, વર્ગ-૦૧, તજજ્ઞ સેવા
૦૭	૧૦૫/૧૮-૧૯	ઇએનટી સર્જન, વર્ગ-૦૧, તજજ્ઞ સેવા
૦૮	૧૦૬/૧૮-૧૯	રેડિયોલોજિસ્ટ, વર્ગ-૦૧, તજજ્ઞ સેવા
૦૯	૧૦૭/૧૮-૧૯	મનોરોગચિકિત્સક, વર્ગ-૦૧, તજજ્ઞ સેવા
૧૦	૧૧૧/૧૮-૧૯	ખેતી અધિકારી, વર્ગ-૨
૧૧	૧૦૦/૧૮-૧૯	સહાયક મોટર વાહન નિરીક્ષક, વર્ગ-૩
૧૨	૧૧૨/૧૮-૧૯	પોલીસ ઇન્સ્પેક્ટર (બિન હથિયારી) વર્ગ-૨
૧૩	૧૧૩/૧૮-૧૯	ગુજરાત ઇજનેરી સેવા (સિવિલ) વર્ગ-૧ અને વર્ગ-૨

૧૪	૮૧/૧૮-૧૯	સરકારી વિનયન, વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજમાં ઈતિહાસ ના મદદ. પ્રાધ્યાપક, વર્ગ-૨
૧૫	૮૩/૧૮-૧૯	સરકારી વિનયન, વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજમાં વનસ્પતિશાસ્ત્ર ના મદદ. પ્રાધ્યાપક,વર્ગ-૨
૧૬	૮૫/૧૮-૧૯	સરકારી વિનયન, વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજમાં એકાઉન્ટસીના મદદ. પ્રાધ્યાપક, વર્ગ-૨
૧૭	૮૬/૧૮-૧૯	સરકારી વિનયન, વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજમાં ગુજરાતી ના મદદ. પ્રાધ્યાપક, વર્ગ-૨
૧૮	૮૭/૧૮-૧૯	સરકારી વિનયન, વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજમાં ગણિતશાસ્ત્ર ના મદદ. પ્રાધ્યાપક, વર્ગ-૨
૧૯	૮૮/૧૮-૧૯	સરકારી વિનયન, વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજમાં સમાજશાસ્ત્ર ના મદદ. પ્રાધ્યાપક, વર્ગ-૨
૨૦	૮૯/૧૮-૧૯	સરકારી વિનયન, વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજમાં અંગ્રેજી ના મદદ. પ્રાધ્યાપક, વર્ગ-૨
૨૧	૯૦/૧૮-૧૯	સરકારી વિનયન, વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજમાં ભૌતિકશાસ્ત્ર ના મદદ. પ્રાધ્યાપક, વર્ગ-૨
૨૨	૯૧/૧૮-૧૯	સરકારી વિનયન, વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજમાં અર્થશાસ્ત્ર ના મદદ. પ્રાધ્યાપક, વર્ગ-૨
૨૩	૯૨/૧૮-૧૯	સરકારી વિનયન, વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજમાં વાણિજ્ય ના મદદ. પ્રાધ્યાપક, વર્ગ-૨
૨૪	૯૩/૧૮-૧૯	સરકારી વિનયન, વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજમાં રસાયણશાસ્ત્ર ના મદદ. પ્રાધ્યાપક,વર્ગ-૨
૨૫	૯૪/૧૮-૧૯	સરકારી વિનયન, વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજમાં રાજ્યશાસ્ત્ર ના મદદ. પ્રાધ્યાપક,વર્ગ-૨
૨૬	૯૭/૧૮-૧૯	સરકારી વિનયન, વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજમાં તત્વજ્ઞાન ના મદદ. પ્રાધ્યાપક, વર્ગ-૨
૨૭	૯૮/૧૮-૧૯	સરકારી વિનયન, વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજમાં મનોવિજ્ઞાન ના મદદ. પ્રાધ્યાપક, વર્ગ-૨

ઉમેદવારો માટે સૂચનાઓ.

- (૧) ઉપરોક્ત જાહેરાતો અન્વયે, મૂળ જાહેરાતમાં જે ઉમેદવારોએ સામાન્ય (GENERAL) કેટેગરીમાં અરજી કરી હોય અને હવે આર્થિક રીતે અનામતનો લાભ મળવા પાત્ર હોય (એટલે કે જે ઉમેદવારો હવે EWS Category માં આવતા હોય) તેમણે જે તે જાહેરાત અન્વયે પુનઃ EWS Category હેઠળ અરજી કરવાની રહેશે.
- (૨) મૂળ જાહેરાતમાં જે ઉમેદવારોએ અરજી કરેલ છે અને જેમને આર્થિક રીતે નબળા વર્ગોના અનામતનો લાભ મળવાપાત્ર નથી તેવા ઉમેદવારોએ સુધારેલ જાહેરાત અન્વયે ફરીથી અરજી કરવાની રહેશે નહિ. અલબત્ત મૂળ જાહેરાતમાં અરજી કરેલ ન હોય તેવા તમામ કેટેગરીના ઉમેદવારો સુધારેલ જાહેરાત અન્વયે અરજી કરી શકશે.
- (૩) ઉપલી વય મર્યાદા માટે મૂળ જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ધ્યાને લેવામાં આવશે. જ્યારે શૈક્ષણિક લાયકાત અને અનુભવ માટે સુધારેલ જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ધ્યાને લેવામાં આવશે.

(૪) આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારોએ રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા. ૨૫.૦૧.૨૦૧૯ ના ઠરાવ ક્રમાંક : ઇ.ડબલ્યુ.એસ/૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ થી નિયત થયેલ નમૂના (અંગ્રેજીમાં Annexure KH અથવા ગુજરાતીમાં પરિશિષ્ટ-ગ) માં મેળવેલ પાત્રતા પ્રમાણપત્ર (અર્થાત તેઓ EWS Category હેઠળ આવે છે તે મતલબનુ પ્રમાણપત્ર)ના નંબર અને તારીખ ઓન લાઇન અરજી કરતી વખતે દર્શાવવાના રહેશે.

(૫) આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારોએ પરીક્ષા ફી અને અરજીપત્રકની કિંમત ચુકવવાની રહેતી નથી.

(૬) આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં ૪૫ વર્ષથી વધે નહિ તે રીતે પાંચ વર્ષ સુધી છૂટ છાટ મળવાપાત્ર રહેશે. આર્થિક રીતે નબળા વર્ગોની મહિલા ઉમેદવારના કિસ્સામાં ઉપલી વય મર્યાદામાં ૪૫ વર્ષથી વધે નહિ તે રીતે ૧૦ વર્ષ સુધી છૂટ છાટ મળવાપાત્ર રહેશે.

(૭) મૂળ જાહેરાત અન્વયે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ વર્ષ ૨૦૧૮-૧૯ ની હોઇ, તા. ૦૧/૦૪/૨૦૧૬ ના રોજ કે ત્યારબાદનું પરંતુ સુધારા જાહેરાત અન્વયે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇસ્યુ કરવામાં આવેલ “ઉન્નત વર્ગમાં સમાવેશ નહિ થવા અંગેનું પ્રમાણપત્ર” Non Creamy Layer Certificate (NCLC) માન્ય ગણાશે. પરંતુ તે પ્રમાણપત્ર સુધારા જાહેરાત અન્વયે ઓન લાઇન અરજી કરવાની છેલ્લી તારીખ બાદનું હોવું જોઇશે નહિ

નોંધ: ઉન્નત વર્ગમાં સમાવેશ નહીં હોવા અંગેના પ્રમાણપત્રની માન્યતા/સ્વીકૃતિ તથા સમયગાળા અને અવધિના અર્થઘટન બાબતે સરકારશ્રીના ઠરાવો/પરિપત્રોની જોગવાઈ આખરી ગણાશે.

તા. ૧૫.૦૩.૨૦૧૯

ગાંધીનગર.